

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

વાહનની હરાજના નિયમો તથા બાંહેધરી પત્રક

1. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીનું વાહન સેવરોલેટ ટવેરા ડીઝલ કાર G 06 G 1792 તા.૨૪/૬/૨૦૨૧ના રોજ બપોરે.૧૨.૦૦કલાકે હરાજથી નિકાલ કરવાનો છે.
2. વાહનની હરાજમાં ભાગ લેવા માટે સેવરોલેટ ટવેરા ડીઝલ કાર G 06 G 1792 માટે રૂ.૬૦૦૦/- ડીપોઝિટની રકમ રોકડા ભરવાના રહેશે.
3. સેવરોલેટ ટવેરા કાર G 06 G 1792નું મોડેલ નંબર - ૨૭/૦૯/૨૦૧૨નું છે તથા આ વાહન ડીઝલ છે.
4. હરાજમાં ભાગ લેનારે ડિપોઝિટ જમા કરાવેલ હશે તો અપસેટ કિંમત માટેની તેની બોલી ગણાશે અને હરાજના દિવસે જો અપસેટ કિંમત ન બોલે તો ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.
5. વાહન માટે તા.૫/૬/૨૦૨૧ થી તા.૨૪/૬/૨૦૨૧ સુધી ૧૧.૦૦કલાક સુધી નિયત સમયમર્યાદા સુધીમાં ડીપોઝિટ ભરનાર ઇસમ જ હરાજમાં ભાગ લઇ શકશે. તે સિવાયની કોઇ વ્યક્તિ હરાજમાં ભાગ લેવા હક્કદાર રહેશે નહીં. ડીપોઝિટ ભર્યાની પહોંચ હરાજ સમયે સાથે રાખવાની રહેશે. હરાજની શરૂઆત તળિયાની કિંમત (અપસેટ પ્રાઇઝ) કરવામાં આવશે. સેવરોલેટ ટવેરા ડીઝલ કારની અપસેટ કિંમત રૂ.૬૦,૦૦૦/- છે અને જ્યાં સુધી કોઇપણ ભાગ લેનાર બોલવાનું ચાલુ રાખે ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યારે બોલી બોલવાનું બીલકુલ બંધ અટકી જાય ત્યારે ત્રણ વાર તક આપ્યા પછી છેલ્લે સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિને સદરહું ગાડી વેચાણ આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
6. હરાજમાં ભાગ લેવા પહેલાં મોબાઇલ ફોન જમા કરાવવાનો રહેશે.
7. સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિને સદરહું વાહન વેચાણ આપવું કે કેમ? તેનો આખરી નિર્ણય કરવાની સત્તા માન.અધ્યક્ષશ્રીને રહેશે.
8. સૌથી વધુ બોલી બોલનારે તુરંત જ પોતે બોલેલ રકમના ઓછામાં ઓછા ૫૦% જેટલી રકમ સ્થળ ઉપર જમા કરાવવાની રહેશે અને બાકીની રકમ હરાજ મંજુર થયેથી વધુમાં વધુ ૩ દિવસમાં જમા કરાવવાની રહેશે. જો રકમ જમા કરવામાં નહિ આવે તો ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવશે. ત્યારબાદ મહત્તમ ભાવ ભરનાર H2 ને બોર્ડ તરફથી ઓફર કરવામાં આવશે અને જો H2 પણ નિષ્ફરળ નિવડશે તો H3ને બોર્ડ તરફથી વિધિવત ઓફર કરવામાં આવશે. જે બાબત હરાજમાં ભાગ લેનાર દરેક ઇજારદારે ધ્યાન રાખવાની રહેશે.
9. હરાજની બોલી રૂ.૧૦૦૦ના ગુણાંકમાં બોલવાની રહેશે.
10. સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિ સિવાયની અન્ય વ્યક્તિઓને સ્થળ ઉપર તેઓની ડીપોઝિટ અસલ પહોંચ રજૂ કરતાં પરત કરવામાં આવશે.
11. વાહનની સંપૂર્ણ રકમ જમા કરાવ્યા પછી સદરહું વાહન પોતાના નામે કરવા માટે જરૂરી ટેક્સ ભરવા તેમજ નવા રજીસ્ટ્રેશન નંબર મેળવવા આર.ટી.ઓ / ઇન્સ્યોરન્સની સઘળી કાર્યવાહી કરાવવાની રહેશે. જે માટે જરૂરી કાગળો અત્રેથી આપવામાં આવશે. તે અન્વયે જરૂરી

કાર્યવાહી પૂર્ણ કરીને તે અંગેના કાગળો અત્રેની કચેરીમાં રજૂ કર્યેથી વાહનનો કબ્જો વેચાણના પ્રમાણપત્ર સાથે આપવામાં આવશે. વાહનની હરાજીની મંજૂર થયેલ કિંમત ઉપરાંત નિયમોનુસાર GST ની રકમ અલગથી ભરવાની રહેશે.

12. વાહનનો કબ્જો જે તે સ્થિતિમાં સૌથી વધુ બોલી બોલનાર વ્યક્તિએ ઉપર ક્રમાંક:૮ ની કાર્યવાહી પૂર્ણ થયા પછી ત્રણ (૩) દિવસમાં લઈ જવાનો રહેશે. અન્યથા સમગ્ર જવાબદારી જે તે વ્યક્તિની રહેશે.
13. ઉક્ત વાહન તા.૫/૬/૨૦૨૧ થી તા.૨૩/૬/૨૦૨૧ (૨જા સિવાય) કચેરી કામકાજ દરમ્યાન બોર્ડની કચેરીએ જોઈ શકાશે.
14. આ બાબતમાં કોઈ વિવાદને અવકાશ રહેશે નહિ. કોઈપણ બાબતમાં માન. અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી ગણાશે.

બાંહેધરી પત્રક

ઉપરોક્ત હરાજીમાં ભાગ લેવા માટે મેં જરૂરી ડિપોઝિટ પહોંચ નં અને તા..... થી ભરેલ છે અને હરાજીમાં ઉપરોક્ત નિયમ સાથે સહમત થાઉ છું.

સ્થળ : ગાંધીનગર

તારીખ :

(હરાજીમાં ભાગ લેનારની સહી)

નામ :

સરનામું :

મોબાઇલ નંબર :